



# ગુજરાત જાહેર સેવા આયોગ

## અગત્યની જાહેરાત

આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ નીચે મુજબની વિગતની જાહેરાતોની પ્રાથમિક પરીક્ષા ગાંધીનગર ખાતે યોજાનાર છે. આ જગ્યાઓની પ્રાથમિક કસોટીનો અભ્યાસક્રમ આયોગની વેબસાઇટ <https://gpsc.gujarat.gov.in/> પર ઉપલબ્ધ છે.

ક્રમ	જગ્યાનું નામ	જાહેરાત ક્રમાંક	પ્રાથમિક કસોટી તારીખ અને સમય	પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાની તારીખ	
(૧)	(૨)	(૩)	(૪)	(૫)	
૧	સરકારી વિનયન,	અર્થશાસ્ત્ર	૯૧/૨૦૧૮-૧૯	૦૮/૦૯/૨૦૧૯ સવારે ૧૧:૦૦ થી ૦૨:૦૦	૨૯/૦૮/૨૦૧૯ ૧૩:૦૦ કલાકથી
૨	વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજો	રસાયણશાસ્ત્ર	૯૩/૨૦૧૮-૧૯	૦૮/૦૯/૨૦૧૯ સવારે ૧૧:૦૦ થી ૦૨:૦૦	૨૯/૦૮/૨૦૧૯ ૧૩:૦૦ કલાકથી
૩	ખાતે વિવિધ	પ્રાણીશાસ્ત્ર	૯૫/૨૦૧૮-૧૯	૦૮/૦૯/૨૦૧૯ સવારે ૧૧:૦૦ થી ૦૨:૦૦	૨૯/૦૮/૨૦૧૯ ૧૩:૦૦ કલાકથી
૪	વિષયોના મદદનીશ પ્રાધ્યાપક,	કાયદાશાસ્ત્ર	૯૬/૨૦૧૮-૧૯	૧૫/૦૯/૨૦૧૯ સવારે ૧૧:૦૦ થી ૦૨:૦૦	૦૪/૦૯/૨૦૧૯ ૧૩:૦૦ કલાકથી
૫	(ગુ.શિ.સે.) વર્ગ-૨	મનોવિજ્ઞાન	૯૮/૨૦૧૮-૧૯	૧૫/૦૯/૨૦૧૯ સવારે ૧૧:૦૦ થી ૦૨:૦૦	૦૪/૦૯/૨૦૧૯ ૧૩:૦૦ કલાકથી
૬	લેકચરર (હોમિયોપેથીક ફિજિયોલોજી), વર્ગ-૨		૬૭/૨૦૧૮-૧૯	૦૮/૦૯/૨૦૧૯ સવારે ૧૧:૦૦ થી ૦૨:૦૦	૨૯/૦૮/૨૦૧૯ ૧૩:૦૦ કલાકથી

નોંધ:- (૧) જાહેરાત ક્રમાંક-૯૫/૨૦૧૮-૧૯, જા.ક-૯૬/૨૦૧૮-૧૯ અને જા.ક-૯૮/૨૦૧૮-૧૯ની પ્રાથમિક કસોટીઓ કોમ્પ્યુટર આધારીત CBRT (Computer Based Recruitment Test) મારફતે લેવામાં આવશે.

(૨) CBRT પદ્ધતિ અંગેની જરૂરી સુચનાઓ / માહિતી આયોગની વેબસાઇટ પર સમયાંતરે જણાવવામાં આવશે. તદ્દનુસાર ઉમેદવારોએ વેબસાઇટની મુલાકાત લઈને અદ્યતન માહિતીથી જાણકાર (update) થવાનું રહેશે.

(૩) જા.ક-૯૫/૨૦૧૮-૧૯, જા.ક-૯૬/૨૦૧૮-૧૯ અને જા.ક-૯૮/૨૦૧૮-૧૯ની પ્રાથમિક કસોટીના દિવસે ઉમેદવારોએ પરીક્ષા ખંડમાં સવારે ૧૦:૦૦ કલાકે અચૂક હાજર થવાનું રહેશે.

ઉપરોક્ત તમામ ૦૬ જાહેરાતોમાં જે ઉમેદવારોના અરજીપત્રક કન્ફર્મ થયેલ છે તેવા તમામ ઉમેદવારોને આ કસોટીમાં કામચલાઉ ધોરણે ઉપસ્થિત થવા દેવાનો આયોગે નિર્ણય કરેલ છે. ઉપર્યુક્ત જાહેરાતોના સંબંધિત ઉમેદવારોએ કોલમ-૫ માં દર્શાવેલ તારીખે બપોરના ૧૩:૦૦ કલાક થી પરીક્ષાના દિવસે પરીક્ષા શરૂ થાય ત્યાં સુધીમાં પોતાના પ્રવેશપત્ર, હાજરીપત્ર તથા ઉમેદવારોની સુચનાઓ (પરિશિષ્ટ-૧ અને ૨) “Online” ડાઉનલોડ કરવાના રહેશે. પ્રવેશપત્ર “Online” ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ નીચે મુજબ તબક્કાવાર/સ્તેપવાઈઝ કાર્યવાહી કરવાની રહે છે. (૧) <https://gpsc-oias.gujarat.gov.in> પર જવું. (૨) “Call Letter/Form” >> “Preliminary Call Letter” પર “Click” કરવું. (૩) અહીં ઉમેદવારે પોતાની “Job Select” કરવી તથા “Confirmation Number” અને “Birth Date” ટાઈપ કરવાના રહેશે. (૪) હવે “Print Call Letter” પર “Click” કરી પ્રવેશપત્રની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. હાજરીપત્રકમાં નોંધની અંદર પરિશિષ્ટ-૧ અને પરિશિષ્ટ-૨ પર “Click” કરવાથી ઉમેદવારની સુચનાઓ પરિશિષ્ટ-૧ અને પરિશિષ્ટ-૨ની પ્રિન્ટ નીકળશે. આ તમામ દસ્તાવેજોની પ્રિન્ટ અચૂક કાઢવામાં આવે તેની નોંધ લેવી. પ્રવેશપત્ર અને હાજરીપત્રક અલગ અલગ કાગળ પર પ્રિન્ટ કરવાના રહેશે. પરીક્ષા સમયે બંને સાથે લાવવાના રહેશે. ફોટાવાળું હાજરીપત્રક પરીક્ષાખંડમાં પરત સોંપવાનું રહેશે. જે ઉમેદવારોના ફોટા હાજરીપત્રકમાં સ્પષ્ટ જોઈ શકાય તેવા આવેલા ન હોય તેવા ઉમેદવારોએ પોતાનો પાસપોર્ટ સાઈઝનો તાજેતરનો ફોટો પરીક્ષાકેન્દ્ર પર લાવવાનો રહેશે. આ ફોટો ઉમેદવારનો પોતાનો છે તેની સ્પષ્ટતા માટે ફોટાવાળું ઓળખપત્ર સાથે રાખવું આવશ્યક છે.

ખાસ નોંધ:- પોસ્ટ ઓફિસ/ઓનલાઇન અરજી ફી ભરેલ નથી તેવા બિનઅનામત કક્ષાના ઉમેદવારો પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશે નહીં. આ ઉમેદવારોએ પ્રથમ આયોગની કચેરી (સરનામું: એરફોર્સ કચેરીની સામે, છ-૩ સર્કલ પાસે, ‘છ’ રોડ, સેક્ટર-૧૦-એ, ગાંધીનગર) ખાતે પરીક્ષાના આગલા કામકાજના દિવસ સુધીમાં કચેરી સમય દરમિયાન રૂબરૂમાં આવી પ્રોસેસ ચાર્જ રૂ.૫૦૦/- રોકડથી ભરવાના રહેશે. ત્યારબાદ જ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાની પરવાનગી આપી શકાશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. જે ઉમેદવારોના અરજીપત્રક કન્ફર્મ થયેલ હોય અને સમય મર્યાદામાં અરજી ફી ભરેલ હોય, છતાં પ્રવેશપત્ર ડાઉનલોડ થતો ન હોય અથવા વેબસાઇટ પર “Application Not Found” નો મેસેજ આવતો હોય તેવા ઉમેદવારોને પરીક્ષાના આગલા કામકાજના દિવસ સુધીમાં આયોગની કચેરી ખાતે કચેરી સમય દરમિયાન અરજી કર્યાના પુરાવા સહિત રૂબરૂ સંપર્ક સાધવા જણાવવામાં આવે છે.

તારીખ-૨૯/૦૮/૨૦૧૯

follow us on: [@GPSC\\_OFFICIAL](https://twitter.com/GPSC_OFFICIAL)



<https://gpsc.gujarat.gov.in>



GPSC (Official)